



6th January, 2023

To,

BSE Limited

The Deputy Manager (Listing - CRD)

Phiroze Jeejeebhoy Towers,

Dalal Street, Fort

Mumbai - 400001

Script Code: 533151

ISIN: INE950I01011

The National Stock Exchange of India Limited

The Manager (Listing Department),

Exchange Plaza Block G, Bandra Kurla Complex

Bandra (East)

Mumbai - 400051

Symbol: DBCORP

Sub.: Newspaper advertisements giving notice to the shareholders of the Company about proposed transfer of Unclaimed Dividend and underlying Equity Shares of D. B. Corp Limited ('the Company') to Investor Education and Protection Fund ('IEPF') Authority

Ref.: Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ('SEBI Listing Regulations')

Dear Sir/ Madam,

Pursuant to Regulation 47 of the SEBI Listing Regulations, please find enclosed herewith copies of the Notice to the Equity Shareholders of the Company in respect of the proposed Transfer of Unclaimed Dividend and underlying Equity Shares of the Company to the IEPF Authority as per the provisions of the Companies Act, 2013 read with the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016, as amended from time to time, published in the following newspapers:

1. Financial Express (English – All India Editions)- on 6th January, 2023
2. Divya Bhaskar (Gujarati – Ahmedabad Edition)- on 6th January, 2023

The said advertisements are also being made available on the Company's website at <https://dbcorpltd.com>.

You are requested to take the above information on your records.

Thanking you.

Yours truly,

For D. B. Corp Limited

Anita Gokhale

Company Secretary

Encl.: As above



India's Largest Newspaper Group | 12 States | 64 Editions | 3 Languages

Registered Office :

Plot No. 280, Sarkhej-Gandhinagar Highway,
Near YMCA Club, Makarba,
Ahmedabad - 380 051, Gujarat

Corporate Office :

501, 5th Floor, Naman Corporate Link,
Opp. Dena Bank, C-31, G Block,
Bandra Kurla Complex, Bandra (East),
Mumbai - 400 051, Maharashtra

D. B. Corp Limited

CIN: L22210GJ1995PLC047208

Website: www.dbcorpltd.com

Email: dbcs@dbcorp.in

Tel.: +91 22 7157 7000 Fax: +91 22 7157 7093

16 COMPANIES

800 global firms for Auto Expo's components show

VIKRAM CHAUDHARY
New Delhi, January 5

EVEN THOUGH SOME big automakers like Hero Moto-Corp, Bajaj and Mahindra are not taking part in the Auto Expo 2023, the components show of the Auto Expo has shaped out well, with participation from over 800 companies, spokespersons from the Automotive Component Manufacturers Association of India (ACMA) said on Thursday.

To be held from January 12-15 at Pragati Maidan in Delhi, the components show is parallel to the Motor Show (held at India Expo Centre in Greater Noida, near Delhi, from January 13-18).

"The components show this year has shaped very well. With participation from over 800 companies, several of them from overseas, we have been completely sold out," Sunjay Kapur, president, ACMA, and chairman, Sona Comstar, said. "Against the backdrop of strong economic recovery and rising vehicle sales in the country, the components show is expected to create new opportunities for the components industry as also provide a platform to showcase its prowess as it strives to stay relevant in a fast-transforming industry."

This year the components show will have a new platform for future technologies and innovations, called the Techno-nation.

"With Auto Expo returning after a hiatus of three years, the overwhelming response to the components show is a testimony to the industry's indomitable spirit of resilience," Kapur said.

The components show this



Against the backdrop of strong economic recovery ... the components show is expected to create new opportunities for the industry

SUNJAY KAPUR,
ACMA PRESIDENT

year will be the largest ever in size, spread over an area of over 60,000 square metres covering the newly constructed halls (A2 to A5) at Pragati Maidan.

The 800-odd companies participating at the show come from 15 countries, and the spokespersons said the show is expected to be attended by over 100,000 visitors from 40 countries.

Vipin Sondhi, chairman, CII National Committee on Future Mobility and Battery Storage, and chairman, CII National Committee on Technology R&D and Innovation, added that the components show will be reflective of trends including electric mobility, ADAS, biofuel and flex-fuel based engine technologies, vehicle safety, sustainable and ecologically sound manufacturing practices, start-ups, and more.

● BUT 10% DIP FROM PRE-COVID CY19

Auto retail sales up 15% in CY22

FE BUREAU
New Delhi, January 5


RETAIL AUTO SALES across segments grew 15.28% to 21.1 million units in calendar year 2022 on the back of strong performance in the passenger vehicle and tractor segments, Federation of Automobile Dealers Associations (FADA) said on Thursday.

Passenger vehicle (PV) retail sales were up 16.35% at 3.4 million units, while two-wheeler retail sales grew 13.37% to 15.38 million units.

FADA president Manish Raj Singhania said, "For CY2022, while total vehicle retail grew 15.28% year-on-year and 17% compared to CY20, they failed to surpass CY19 retail (a pre-Covid year) and fell 10%."

He further said, "The PV category during this period continued to gain new grounds by clocking 3.43 million retail sales during the full year. This is by far,

IN THE FAST LANE



Source: FADA Research

the highest retail sales which PV category has done till date."

Singhania, however, said the two-wheeler segment had once again failed to impress as retail sales in December continued to fall after two good months. "Due

to reasons like rise in inflation, increased cost of ownership, rural market yet to pick up fully and increased EV sales, the ICE (internal combustion engine) two-wheeler segment is yet to see any green shoots," he said.

In 2022, commercial vehicles retail sales grew 31.97% to 865,344 units. "The CV segment has continued to grow throughout CY2022 and is now almost on a par with CY2019 retail sales. With an uptick in demand in

Godrej Consumer sees surge in sales in Q3

KRITIKA ARORA
Mumbai, January 5

GODREJ CONSUMER PRODUCTS expects double-digit sales growth backed by low single-digit volume growth in the domestic market for the quarter ended December.

The quarter saw softness in demand driven by poor rural consumption and a slowdown after the festive season, the company said in a regulatory filing. Nevertheless, the slow growth came on the back of double-digit sales growth in both home care and personal care, the company said.

Sequentially, there has been improvement from high single-digit sales growth and mid single-digit volume decline in the previous quarter.

The company's Indonesia business, which contributed 12% to consolidated sales, has started to see gradual recovery, with constant currency sales decline in low single digits, the company said. In September quarter, the Indonesia business had seen sales drop by 8% on

year and decline in profitability. Godrej India, USA, and Middle East clocked double-digit sales growth in constant currency terms.

At a consolidated level, the company expects improved execution amid rising orders, while that in the next fiscal will be supported by a strong order backlog and steady inflow of fresh orders. The capital goods companies comprise Engineering, Procurement and Construction (EPC) service providers excluding road and civil construction and equipment manufacturers.

Higher commodity prices, rising government and private sectors on infrastructure and steady investment in private capital expenditure in consumption-based sectors, including due to investment in production linked incentive

Capital goods firms' revenue to rise up to 18% in FY23, 10-12% in next: Crisil

RAJESH KURUP
Mumbai, January 5

MARKING TWO CONSECUTIVE years of strong growth, capital goods firms are expected to post a healthy 16-18% rise in revenue in this financial year — despite a 20% growth in last fiscal — and 10-12% rise in the next fiscal.

This comes after a sluggish growth for the sector in the decade up to FY21 (2011-21), according to a report by Crisil Ratings.

The growth in this financial year for the capital goods companies would be due to improved execution amid rising orders, while that in the next fiscal will be supported by a strong order backlog and steady inflow of fresh orders. The capital goods companies comprise Engineering, Procurement and Construction (EPC) service providers excluding road and civil construction and equipment manufacturers.

Higher commodity prices, rising government and private sectors on infrastructure and steady investment in private capital expenditure in consumption-based sectors, including due to investment in production linked incentive

ON GROWTH TRAJECTORY

The order book expanded about 14% on-year in FY22 and by 9% in the first half to ₹3.9 trillion.

Consequently, as of September 2022 was 3.82 times the revenue in FY22, up from the pre-Covid level of 2.94 times

(PLI) schemes, have resulted in strong order book growth, the report said.

The order book expanded about 14% on-year in FY22 and by 9% in the first half of this fiscal to ₹3.9 trillion. Consequently, the order books as of September 2022 was 3.82 times the revenue in FY22, up from the pre-Covid level of 2.94 times.

"Supportive public expenditure stemming from government thrust on infrastructure and focused execution augur well for capital goods companies supply chain to cement, energy and

ON GROWTH TRAJECTORY

The order book expanded about 14% on-year in FY22 and by 9% in the first half to ₹3.9 trillion.

Consequently, as of September 2022 was 3.82 times the revenue in FY22, up from the pre-Covid level of 2.94 times

(PLI) schemes, have resulted in strong order book growth, the report said.

The order book expanded about 14% on-year in FY22 and by 9% in the first half of this fiscal to ₹3.9 trillion. Consequently, the order books as of September 2022 was 3.82 times the revenue in FY22, up from the pre-Covid level of 2.94 times.

"Supportive public expenditure stemming from government thrust on infrastructure and focused execution augur well for capital goods companies supply chain to cement, energy and

NCLAT upholds NCLT's Wave order

THE NCLAT ON Thursday upheld an order of NCLT which dismissed a plea by real estate firm Wave Megacity Centre to initiate insolvency proceedings against itself and imposed a fine of ₹1 crore.

The insolvency appellate tribunal ordered that the company's plea to initiate insolvency proceedings against itself under Section 10 of the IBC was with "malicious purpose" and "was to save the Corporate Debtor from liabilities, responsibilities and prosecution".

In June last year, the Delhi-based principal bench of the National Company Law Tribunal (NCLT) rejected the plea filed by Wave Megacity Centre, which is developing commercial and residential projects in sectors 25A and 32 of Noida, Uttar Pradesh. — PTI

IRIS Business Services Limited
Reg. Off: T-231, Tower 2, 3rd Floor, International Infotech Park, Vashi, Navi-Mumbai - 400 703, Maharashtra, India.
Tel: +91 22 67231000, Fax: +91 22 27814834,
Email: cis@irisbusiness.com, Web: www.irisbusiness.com,
CIN: L29300MH2000PLC128943

NOTICE OF POSTAL BALLOT

Members of IRIS Business Services Limited ("IRIS" or the "Company") are hereby informed that pursuant to the provisions of Section 110 of the Companies Act, 2013 read with Rule 20 and Rule 22 of the Companies (Management and Administration) Rules, 2014, Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, Secretarial Standard on General Meetings issued by The Institute of Company Secretaries of India (SS-2), and as amended from time to time, and all the applicable circulars issued by the Ministry of Corporate Affairs ("MCA") and the Securities & Exchange Board of India ("SEBI"), we are furnishing the following details:

a. The business to be transacted by voting through Postal Ballot which includes voting by electronic means (e-voting) for seeking approval of the members for the following matter:

1. APPOINTMENT OF MR. PUTHENPRAKASH KUNHERA XAVIER THOMAS (P.K.X. THOMAS) (CIN: 00762233) AS A WHOLE-TIME DIRECTOR OF THE COMPANY.

b. The Company has on Thursday, January 05, 2023 completed the dispatch of the Postal Ballot Notice and explanatory statement along with the Postal Ballot Form(s) to all the members whose name(s) appeared on the Register of members as of the last business day on Friday, December 23, 2022 (cut-off date) by the prescribed mode. The Company has availed services of The National Securities Depository Limited ("NSDL") to provide an e-voting facility. The date and time of commencement of electronic means and Postal Ballot shall be Friday, January 06, 2023 (9:00 am IST). The date and time of end of voting through electronic means and Postal Ballot shall be Saturday, February 04, 2023 (5:00 pm IST). Any Postal Ballot form received from a member beyond Saturday, February 04, 2023 (5:00 pm IST) will not be valid and shall be treated as if no reply from the member has been received. The e-voting platform will be managed by NSDL thereafter. The members who have not received the Postal Ballot Form may apply to the Company / Registrar / Link Intime India Private Limited (hereinafter referred to as "Registrar") to receive the Postal Ballot and Postal Ballot Form are also displayed on the website of the Company at www.irisbusiness.com and on website of NSDL at www.evoting.nsdl.com.

c. Process for those shareholders whose email IDs are not registered with the depositories for procuring user ID and password and registration of email IDs for e-voting for the election shall be as follows:

- In case shares are held in physical mode, please provide Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), Aadhaar (self-attested scanned copy of Aadhaar card) by email to cis@irisbusiness.com to get email ID registered.
- In case shares are held in demat mode, please provide DPID-CUID (16 digit DPID + CUID or 16 digit beneficiary ID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self-attested scanned copy of PAN card), Aadhaar (self-attested scanned copy of Aadhaar card) to cis@irisbusiness.com to get email ID registered.

d. For permanent registration of email address, members are requested to register their electronic address in respect of electronic means and their concerned Depository Participants and in respect of physical holdings, with the Company's RTA, Link Intime India Private Limited, C-101/247 Park, L.B. S. Marg, Vikhroli (West), Mumbai - 400083 by following due procedure.

e. Contact details of the person responsible to address the grievances connected with the voting by Postal Ballot including voting by electronic means: Mr. Santosh Kumar Sharma, Company Secretary & Compliance Officer, Registered Office: T-231, Tower 2, 3rd Floor, International Infotech Park, Vashi - 400 703, Maharashtra, India. Telephone Number: +91-22-6723 1000, Email ID: cis@irisbusiness.com. The Company has appointed Mr. Priti J. Sheth of M/s. Priti J. Sheth & Associates, Company Secretaries, as the Scrutinizer to conduct the Postal Ballot process in a fair and transparent manner. In case of any queries, you may refer the FAQs for shareholders and for e-voting user manual for shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no. 1800 10 2090 and 1800 22 44 30 or contact Ms. Pallavi Mahatre, Manager, National Securities Depository Ltd., Trade World, A Wing, 4th Floor, Karamia Mills Compound, Senapati Bapat Marg, Lower Parel, Mumbai - 400 013, at the designated email address evoting@nsdl.co.in who will also address the grievances connected with the voting by electronic means. Alternatively, Members may also contact Link Intime India Private Limited, Registrar and Share Transfer Agent of the Company at mumbai@linkintime.co.in. The results of the voting by postal ballot will be declared by Monday, February 06, 2023 at the registered office of the Company. The results of the postal ballot along with the scrutinizer's report will be hosted on the Company's website www.irisbusiness.com and will be communicated to BSE Limited and National Stock Exchange of India Limited.

By Order of the Board of Directors
For IRIS Business Services Limited
Santosh Kumar Sharma
Company Secretary & Compliance Officer
Membership No.: A31339
Place: Vashi, Navi Mumbai Date: Thursday, January 05, 2023

Form No. INC-26 Before the (Central Government) Regional Director, North Western Region Ministry of Corporate Affairs

In the matter of sub-section (4) of Section 13 of the Companies Act, 2013 and date (a) of sub-rule (5) of rule 30 of the Companies (Incorporation) Rules, 2014

In the matter of Aarti Surfactants Limited ("the Company") having its registered office at 801, 801/23, GDC Estate, Phase III Vapi, Valsad - 396195, Gujarat, having CIN: L24100GJ2019PLC102691

... Petitioner Notice is hereby given to the General Public that the company proposes to make application to the Central Government, Regional Director, North Western Region, Ministry of Corporate Affairs, Ahmedabad under section 12 and 13 and other applicable provisions, if any, of the Companies Act, 2013 and rules made thereunder seeking confirmation of alteration of the Memorandum of Association of the Company in terms of the special resolution passed by way of Postal Ballot on December 16, 2022 to enable the company to change its Registered Office from "State of Gujarat" to "State of Madhya Pradesh" under the jurisdiction of Registrar of Companies, Gwalior.

Any person whose interest is likely to be affected by the proposed change of the Registered Office of the company may deliver either on the MCA-21 portal (www.mca.gov.in) by filing investor complaint form or cause to be delivered or sent by registered post of his/her objections stating the nature of his/her interest and grounds of opposition to the Regional Director, North Western Region, Ministry of Corporate Affairs, Ahmedabad under section 12 and 13 and other applicable provisions, if any, of the Companies Act, 2013 and rules made thereunder, within 14 (fourteen) days of the date of publication of this notice with a copy to the applicant company at its registered corporate office as mentioned below along with nature of interest and grounds of opposition:

Regd. Office: Company Secretary 801, 801/23, GDC Estate, Phase III Vapi, Valsad - 396195, Gujarat
Corp. Office: Company Secretary Unit No. 202, Plot 71, Udyog Kshetra, 2nd Floor, Link Intime Corporate Park, Link Road, Mulund West, Mumbai - 400080, Maharashtra

For and on behalf of Aarti Surfactants Limited
Nikhil P. Desai
Managing Director
DIN: 01606649

Place: Mumbai Date: January 06, 2023

AGS LOGISTICS LIMITED
CIN: L26100GJ2019PLC102691
Regd. Office: 308/310, D.C.I.L., New Kurla, Post 396, Vapi, Gujarat
2nd Floor, Link Intime Corporate Park, Link Road, Mulund West, Mumbai - 400080, Maharashtra
Phone: +91 22 2715 7575 Fax: +91 22 2715 7575

NOTICE for the attention of the Equity Shareholders of the Company

Transfer of Dividend/Equity Shares of the Company to Investor Education and Protection Fund Authority Notice is hereby given to the shareholders of the Company pursuant to section 124(6) of the Companies Act, 2013 (the "Act") read with the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016, as amended, ("the Rules"), that the Shareholders who have not claimed or encashed their dividends from the financial year 2015-16 for a period of 7 (seven) consecutive years, the equity shares in respect of which such dividends are lying undclaimed along with their dividend amount for financial year 2015-16 (30th December) will be transferred to the Investor Education and Protection Fund (IEPF) Authority.

In view of the above, the statement containing the full details of the shareholders whose equity shares and the dividend for financial year 2015-16 (30th December) are liable to be transferred to IEPF is uploaded on the Company's website www.agslogistics.com (Path: www.agslogistics.com/investor-information/Dividend-Related-Delisted) > Share Transfer > IEPF > 2022 for information and necessary action by the shareholders.

The shareholders can claim their unpaid or unencashed dividends from the Company by contacting the Company's Registrar and Share Transfer Agent as per the below details in the manner that the dividends are encashed before 15th April, 2023:
Link Intime India Pvt. Ltd., Unit-A, Agis Logistics Limited
C-101, 247 Park, L.B. S. Marg, Vikhroli (West), Mumbai - 400 083
Tel: 022 49186270 | Email: mlhelpdesk@linkintime.co.in
The Company has, vide its circular dated 23rd January 2023, requested shareholders individually, to the latest available addresses of the shareholders, whose dividends are lying undclaimed since financial year 2015-16 (7) (seven) consecutive years, advising them to claim the dividends expeditiously. However, there is possibility that shareholder(s) may face some difficulties in receiving the physical copy of the notice to their registered addresses. In such cases, this Notice may please be considered as individual notice in compliance with the Rules.

In case of a valid claim in respect of undclaimed dividend is received from the shareholders on or before 5 April, 2023 or such any date as may be extended (if any), the Company shall, with a view to complying with the requirements set in the Rules, transfer the shares to the IEPF Authority as per the procedure stipulated in the Rules. However, the concerned shareholders may claim the shares along with the undclaimed dividends from IEPF Authority by filing Form IEPF-5 online and sending the physical copy of the requisite documents enumerated in the Form IEPF-5, to the Nodal Officer of the Company. Please also note that no claim shall be against the Company in respect of shares undclaimed, which are transferred to IEPF pursuant to the Rules.

DB Corp Ltd

Registered Office: Plot No. 280, Sakinaka Ganga Nagar Housing, Near YMCRA Club, Makarand, Amnabad, Gujarat - 380051
Tel: +91 22 7157 7000 | Fax: +91 22 7157 7003

NOTICE FOR THE ATTENTION OF EQUITY SHAREHOLDERS OF THE COMPANY

Transfer of Equity Shares of the Company to Investor Education and Protection Fund (IEPF) Authority Notice is hereby given pursuant to Section 124(6) of the Companies Act, 2013 (the "Act") read with the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 as amended from time to time read with the relevant circulars and amendments thereto (the "Rules").

The Rules, inter-alia, provides that the dividend which has remained unpaid or undclaimed for a period of 7 (seven) consecutive years will be transferred to the bank account of IEPF Authority on the due date during April 2023. Also, underlying shares on which such dividend has remained unpaid or undclaimed for seven consecutive years or more, are to be transferred to the demat account of the IEPF Authority.

In terms of the said Rules, One-time Special Dividend declared by D.B. Corp Limited ("the Company") for the Financial Year 2015-16 which has remained unpaid or undclaimed for a period of seven consecutive years will be credited to the bank account of IEPF Authority on the due date during April 2023. Also, underlying shares on which such dividend has remained unpaid or undclaimed for seven consecutive years or more, are to be transferred to the demat account of the IEPF Authority.

However, the Company does not intend to transfer shares where there is a specific order of Court or Tribunal or any other statutory authority restraining any transfer of shares and payment of dividend or where such shares are pledged or hypothecated under the provisions of the Depositories Act, 1996.

In compliance with the requirements of the said Rules, the Company has communicated individually to all those shareholders whose shares are liable to be transferred to the IEPF Authority vide a letter dated 5th January, 2023, at its registered addresses available with the Company.

The Company has also uploaded on its website www.dbbcorppltd.com, the list of shareholders whose undclaimed dividends/shares are liable for transfer to IEPF Authority. The Shareholders are requested to refer to the aforesaid website to verify the details of undclaimed dividends and the shares which are liable to be transferred to the IEPF Authority and thereafter contact the Company for making a valid claim in respect of such undclaimed dividends and the underlying shares.

In case the Company does not receive any communication from these shareholders by 29th March, 2023, the Company shall, with a view to complying with the requirements set in the Act and the Rules, transfer the undclaimed dividend and the underlying shares to IEPF Authority on the due date after following the procedure stipulated in the Rules which is displayed on the website www.agslogistics.com.

In respect of shares held in Physical Form The Company shall issue duplicate share certificates in lieu of the original share certificates held by the concerned shareholder for the purpose of dematerialisation by way of corporate action and transfer of shares to IEPF Authority as per the Rules and upon such issue, the original share certificates which stand registered in the name of the concerned shareholder shall stand automatically cancelled and be deemed to be non-negotiable.

Oyo writes to NCLT to expedite MCA's FHRAI inquiry

SALMAN SH
Bengaluru, January 5

BUDGET HOTEL UNICORN Oyo, in a recent letter, has requested the National Company Law Tribunal (NCLT) to expedite the ministry of corporate affairs (MCA) investigation into the operations of Federation of Hotel & Restaurant Associations of India (FHRAI).

Recently the NCLT's New Delhi bench passed an order directing MCA to look into the affairs of FHRAI and examine if it conducts itself in a manner compliant with the provisions of the Companies Act. The NCLT order also stated that this was necessary due to allegations of "personal interest" which have come to light over the functioning of FHRAI.

The letter by OYO points out that the present governing body members of the FHRAI, are running a "deleterious and malicious agenda" against the hotel industry.

Thelatter OYO points out that the present governing body members of the FHRAI, are running a "deleterious and malicious agenda" aimed towards ruining the interest of the hotel industry at large.

FHRAI is creating hurdles and obstacles for new players in the market, who are posing a stiff challenge to the self-serving agenda of certain members of the FHRAI with vested interest," the letter stated.

Oyo, in its letter to NCLT, also talked about how FHRAI's actions are allegedly a "worrying development" for the hotel business in the country.

"It does not augur well for the business environment of our country when prominent start-ups... are the subject of such concerted and intimidatory tactics launched by the present committee of FHRAI,

across multiple forums with the sole malicious intent to harm the hotel industry of the country," Oyo added in its representation to NCLT.

FHRAI was formed with the intent to promote the travel and tourism industry, however, there have been allegations of unfair elections and mismanagement by two regional chapters of FHRAI. Oyo, in its letter, to NCLT has questioned the functioning of FHRAI and has also urged to take appropriate action against the erring committee members.

It is important to note that the tussle between Oyo and the FHRAI has been a long-drawn one with the hotel lobby body having publicly accused Oyo of unfair trade practices to monopolies the hotel industry.

The letter by OYO points out that the present governing body members of the FHRAI, are running a "deleterious and malicious agenda" against the hotel industry.

Thelatter OYO points out that the present governing body members of the FHRAI, are running a "deleterious and malicious agenda" aimed towards ruining the interest of the hotel industry at large.

FHRAI is creating hurdles and obstacles for new players in the market, who are posing a stiff challenge to the self-serving agenda of certain members of the FHRAI with vested interest," the letter stated.

Oyo, in its letter to NCLT, also talked about how FHRAI's actions are allegedly a "worrying development" for the hotel business in the country.

"It does not augur well for the business environment of our country when prominent start-ups... are the subject of such concerted and intimidatory tactics launched by the present committee of FHRAI,

